

રૂસ્તમપુરા ખાતે આવેલ મુથ્યુટ ફાયનાન્સની ઓફિસમાં ઘરફોડ કરવા માટે આવેલ રીઠી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર નેપાળી ગેંગને ઝડપી પાડતી, કાઈમ બ્રાન્ચ.

સુરત શહેર વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન સુરત કાઈમ બ્રાંચના HC સત્યમપાલસિંહ મહોબ્બતસિંહ તથા HC જીએશ બાબુભાઈ નાઓને મળેલ બાતમી આધારે રૂસ્તમપુરા કોટક મહેન્દ્ર બેંકની પાછળ છેલ્લા મહોલ્લાના નાકે મુથ્યુટ ફાયનાન્સની ઓફિસ નીચેથી નેપાળી ગેંગના રીઠા આરોપીઓ (૧) રૂપસીંગ કરણસીંગ બિસ્ત રહે-કડોદરા ચાર રસ્તા નિલમ હોટલની પાછળ વિકાસના રૂમમાં કડોદરા તા-પલસાણા જી-સુરત તેમજ તેના સાગરીતો (૨) સાગર દેવરાજ ખાતી રહે-એજન (૩) રોશન નારાયણ પરીહાર રહે-સીગણપોર ચાર રસ્તા પાસે મહાદેવ મંદિરની સામે આવેલ બિલ્ડીંગ નં-૩૪ ના ભોયતળીયે સુરત તમામ મુળ રહે-નેપાળ નાઓને ઘરફોડ કરવાના સાધનો જેમાં (૧) બે લોખંડના ગણેશીયા (૨) એક આરી પાના સાથેની (૪) એક કાપડની થેલી (૫) વગર નંબરની સ્પ્લેન્ડર મો.સા. કુલ્લે રૂ. ૫૦,૨૦૦/- ની મત્તાની સાથે ઝડપી પાડી મજકુર આરોપીઓની પુછપરછમાં પકડાયેલ આરોપી પૈકી રૂપસીંગ કરણસીંગ બિસ્ત તેમજ સાગર દેવરાજ ખાતી નાઓ રીઠા ઘરફોડીયા છે અને અગાઉ મહારાષ્ટ્ર, પુણેમાં ઘરફોડ ચોરીમાં પકડાયે ચુકેલ છે. હાલમાં આરોપી રૂપસીંગ કરણસીંગ બિસ્તે સુરત શહેરમાં મોટી ઘરફોડી કરવાનો પ્લાન બનાવી રૂસ્તમપુરા ખાતે આવેલ મુથ્યુટ ફાયનાન્સની ઓફિસની રેકી કરી, રાત્રીના ઘરફોડ કરવાના ઈરાદે તેના સાગરીતો સાથે આવેલ હતો આ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ત્રણેય આરોપીઓને કાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે. મજકુર આરોપીઓ પૈકી આરોપી રૂપસીંગ કરણસીંગ બિસ્ત નીચે મુજબના ગુન્હાઓમાં વોન્ટેડ હોય, (૧) ચોકબજાર પો.સ્ટે. । ૧૩૭/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ(ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડા રૂપિયા સોના ચાંદીના દાગીનાઓ તેમજ યુ.એસ.ડોલર મળી કુલ્લે રૂ. ૧૧,૯૨,૦૦૦/-) (૨)બારડોલી પો.સ્ટે. । ૩૦/૨૦૧૩ ઈ.પી.કો. કલમ ૩૮૧,૧૧૪ મુજબ (ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડા રૂપિયા સોના ચાંદીના દાગીના મળી કુલ્લે રૂ. ૮૩,૦૦૦/-) (૩)વાપી ટાઉન પો.સ્ટે. । ગુ.ર.નં. ૬૧/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ (સને-૨૦૧૮ ની સાલમાં તેણે તેના સાગરીતો ગોવિંદ બહાદુર સાઓત તેમજ ભરત બહાદુર નાઓની સાથે વાપી જલારામ મંદિર નજીક આવેલ જલધામ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રોકડા રૂ. ૩૨ લાખ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ્લે રૂ. ૩૬,૭૦,૦૦૦/-ના મત્તાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.